


(Continued from previous page...)


INVESTORS, PLEASE NOTE

The details of the allotment made would also be hosted on the website of the Registrar to the Offer, Bigshare Services Private Limited at www.bigshareonline.com.
All future correspondence in this regard may kindly be addressed to the Registrar to the Offer quoting full name of the First/ sole Bidder, Bid cum Application Form number, Bidder DP ID, Client ID, PAN, date of submission of Bid cum Application Form, address of the Bidder, number of Equity Shares applied for, the name and address of the Designated Intermediary where the Bid cum Application Form was submitted by the Bidder and a copy of the Acknowledgment Slip received from the Designated Intermediary at the address given below:

**Bigshare Services Pvt. Ltd.**
Bigshare Services Private Limited
Office No S6-2, 6th Floor, Pinnacle Business Park, next to Ahura Centre, Mahakali Caves Road, Andheri (East) Mumbai – 400 093, Maharashtra, India | **Telephone:** 022 – 6263 8200
Email: ipo@bigshareonline.com | **Website:** www.bigshareonline.com
Investors Grievance E-mail: investor@bigshareonline.com
Contact Person: Babu Rapheal C | **SEBI Registration Number:** INR000001385

For Kaytex Fabrics Limited
Sd/-
Sanjeev Kandhari
Chairman and Managing Director

<div>A. K. Capital Finance Limited</div> <div>Registered Office: 601-602, 6th Floor, Windsor, Off CST Road, Kalina, Santacruz (East), Mumbai – 400 098. Tel: +91 (022) 6754 6500 Fax: +91 (022) 6610 0594 Email: csakcfl@akgroup.co.in CIN: U51900MH2006PLC214277</div> <div>STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2025</div> <div>(₹ In Lakhs except EPS)</div>				
Sr. No.	Particulars	Standalone		
		Current Quarter ended 30 June 2025 (Unaudited)	Corresponding Quarter ended 30 June 2024 (Unaudited)	Previous Year ended 31 March 2025 (Audited)
1	Total Income from Operations	8,879.14	7,657.15	33,396.71
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	2,029.26	1,904.28	8,371.54
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items)	2,029.26	1,904.28	8,371.54
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary items)	1,520.16	1,450.97	6,781.63
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,523.09	1,444.43	6,764.51
6	Paid up Equity Share Capital *	2,654.38	8,829.38	2,654.38
7	Reserves (excluding Revaluation Reserve)	80,625.61	69,626.45	79,102.52
8	Securities Premium Account	33,496.88	27,321.88	33,496.88
9	Net worth	83,279.99	78,455.83	81,756.90
10	Paid up Debt Capital / Outstanding Debt	2,37,326.80	2,18,897.23	2,30,029.02
11	Outstanding Redeemable Preference Shares	-	-	-
12	Debt Equity Ratio	2.85	2.79	2.81
13	Earnings Per Share (of ₹10/- each)**			
	a. Basic	5.73	5.47	25.55
	b. Diluted	5.73	5.47	25.55
14	Capital Redemption Reserve	NA	NA	NA
15	Debtenture Redemption Reserve	NA	NA	NA
* Paid up Equity Share Capital includes Compulsorily Convertible Preference shares of Rs. 6,500 lakhs for quarter ended 30 June 2024.				
** Not Annualised				
Note: a) The above is an extract of the detailed format of annual financial results filed with BSE Limited & National Stock Exchange of India Limited ("Stock Exchanges") under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the annual financial results are available on the website of the Stock Exchanges i.e. www.bseindia.com & www.nseindia.com and on the website of the Company www.akgroup.co.in b) For the other line items referred in Regulation 52 (4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to the Stock Exchanges and can be accessed on the website of the Stock Exchanges i.e. www.bseindia.com & www.nseindia.com c) The above unaudited standalone financial results have been reviewed and recommended by the Audit Committee and thereafter approved by the Board of Directors at their respective meetings held on 02 August 2025. The statutory auditors of the Company have carried out limited review of the aforesaid standalone financial results. d) Debt service coverage ratio and interest service coverage ratio are not applicable. Debtenture redemption reserve is not required in respect of privately placed debtentures in terms of Rule 187(3)(b) of Companies (Share Capital and Debentures) Rule, 2014. e) The previous period figures have been regrouped/reclassified wherever necessary to conform to current period's presentation.				
For and on behalf of the Board of Directors				
A. K. Capital Finance Limited				
Sd/-				
A. K. Mittal				
Managing Director (DIN : 00698377)				
Place: Mumbai				
Date: August 02, 2025				


**TATA INVESTMENT CORPORATION LIMITED**
Elphinstone Building, 10 Veer Nariman Road, Mumbai 400 001.
Tel 91 22 6665 8282 Fax 91 22 6665 7917
CIN: L67200MH1937PLC002622 e-mail ticl@tata.com website: www.tatainvestment.com

Statement of Unaudited Standalone and Consolidated Financial Results for the Quarter ended 30th June, 2025


(Rs. in crores)

Particulars	Standalone				Consolidated			
	Quarter ended		Year Ended		Quarter ended		Year Ended	
	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited
	30-06-2025	31-03-2025	30-06-2024	31-03-2025	30-06-2025	31-03-2025	30-06-2024	31-03-2025
1. Total Income	171.17	51.71	141.68	369.48	146.17	16.61	143.19	306.22
2. Net Profit for the period before Tax	159.62	42.59	130.32	330.68	167.92	35.81	155.71	368.47
3. Net Profit for the period after Tax	139.22	35.20	112.76	282.52	146.30	37.72	131.07	312.09
4. Total Comprehensive Income for the period [Comprising Profit after tax and Other Comprehensive Income (after tax)]	3,770.37	(2,875.14)	2,515.85	1,239.43	3,777.56	(2,872.86)	2,534.12	1,267.33
5. Equity Share Capital	50.60	50.60	50.60	50.60	50.60	50.60	50.60	50.60
6. Earnings Per Share (of Rs.10/- each) Basic / Diluted (in Rs.)	27.52	6.96	22.29	55.84	28.92	7.46	25.91	61.68

Notes:
1. The above is an extract of the detailed format of quarter ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarter ended Financial Results are available on the Stock Exchange websites at www.bseindia.com and www.nseindia.com and also on Company's website www.tatainvestment.com. The same can be accessed by scanning the QR code provided below.


Mumbai, 4th August, 2025

Tata Investment Corporation Limited
(Noel N. Tata)
Chairman
DIN 00024713

**HDB FINANCIAL SERVICES LIMITED**
(CIN: L65993GJ2007PLC051028)
Regd. Office: Radhika, 2nd Floor, Law Garden Road, Navrangpura, Ahmedabad - 380 009
Corporate Office: HDB House, Tukaram Sandam Marg, A-Subhash Road, Vile Parle - (E), Mumbai - 400 057
Tel. No.: +91 22 49116300, Fax No.: +91 22 49116666, Email: investor@hdbfs.com, Website: www.hdbfs.com

NOTICE OF POSTAL BALLOT

Notice is hereby given pursuant to Section 110 read with Section 108 and other applicable provisions, if any, of the Companies Act, 2013, ("Act") (including any statutory modification(s) or re-enactment(s) thereof for the time being in force), read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 ("Rules"), Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), Secretarial Standard on General Meetings issued by the Institute of Company Secretaries of India ("SS-2") as amended, and in accordance with the requirements prescribed by the Ministry of Corporate Affairs ("MCA") for holding general meetings / conducting postal ballot process through electronic voting (remote e-voting) vide General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 22/2020 dated June 15, 2020, 33/2020 dated September 28, 2020, 39/2020 dated December 31, 2020, 10/2021 dated June 23, 2021, 20/2021 dated December 8, 2021, 3/2022 dated May 5, 2022, 11/2022 dated December 28, 2022, 09/2023 dated September 25, 2023 and 09/2024 dated September 19, 2024 ("MCA Circulars") and other applicable laws and regulations, as amended from time to time (including any statutory modification(s) or re-enactment(s) thereof for the time being in force, the approval of the Members of HDB Financial Services Limited ("the Company") is being sought for the following resolutions by way of postal ballot through e-voting process ("remote e-voting"):

Item No.	Resolutions	Resolution Type
1	Ratification of the HDB Financial Services Limited – Employee Stock Option Scheme 2014	Special
2	Ratification of the HDB Financial Services Limited – Employee Stock Option Scheme 2017	Special
3	Ratification of the HDB Financial Services Limited – Employee Stock Option Scheme 2022	Special

Pursuant to the MCA Circulars, the Company has sent the electronic copies of Notice of Postal Ballot ("Notice") along with the explanatory statement on Monday, August 4, 2025 to all the Members of the Company, who have registered their email address with the Depository Participant or Registrar and Share Transfer Agent of the Company i.e. MUFG Intime India Private Limited as on Friday, August 1, 2025 i.e. cut-off date.

The Notice of Postal Ballot is also made available on the following:

- Website of the Company at <https://www.hdbfs.com/investors/> under section 'Investor Services' / 'Postal Ballot'.
- Website of Stock Exchanges where the Company's Equity shares are listed i.e. BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com
- Website of National Securities Depository Limited ("NSDL") at <https://www.evoting.nsdl.com> under section 'Notice Download'.

Kindly note that in compliance with MCA circular, the Company has sent the Postal Ballot Notice in electronic form only, instead of dispatching hard copy of the Notice along with the Postal Ballot Form.

Accordingly, Members can vote only through the remote e-voting process. Members whose names appear as per the records of the Depositories on Friday, August 1, 2025 (i.e. cut-off date) shall only be entitled to cast their vote(s) through remote e-voting and voting right shall be proportionate to their share of the paid-up equity share capital of the Company as on the cut-off date.

The Company has engaged the services of NSDL for providing remote e-voting facility to all its Members.

Some of the important details regarding the remote e-voting are provided below:

EVEN (E-Voting Event Number)	134953
Cut-off date for determining Members entitled to vote	Friday, August 1, 2025
Commencement of remote e-voting	Wednesday, August 6, 2025 at 10:00 a.m. (IST)
Closure of remote e-voting	Thursday, September 4, 2025 at 5:00 p.m. (IST)

During this period, the Members of the Company may cast their vote electronically and once the vote on a resolution is cast by the Member, such Member shall not be allowed to change it subsequently.

Members who have not registered their email address are requested to register their email address with respective depository participants. The link for updating email address and mobile number electronically on a temporary basis is available on the website of MUFG Intime India Private Limited at: https://web.in.mpms.mufg.com/emailreg/email_register.html.

The instructions on the process of remote e-voting are provided in the Notice.

Mr. Mitesh Shah (FCS No.: 10070), of M/s. Mitesh J. Shah & Associates, Practicing Company Secretary, has been appointed as the Scrutiniser for conducting the Postal Ballot in a fair and transparent manner.

In case of any queries relating to remote e-voting, you may refer to the FAQs for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of <https://www.evoting.nsdl.com> or call on toll free no.: 022 - 4886 7000 or send a request at evoting@nsdl.com or Members may also visit: <https://swayam.in.mpms.mufg.com/> for registering their queries or contact the undersigned.

The result of the Postal Ballot along with Scrutinizer's Report will be displayed through Notice Board at the registered and corporate office of the Company, on the Company's website at www.hdbfs.com, on the website of NSDL at www.evoting.nsdl.com and shall also be communicated to the Stock Exchanges where the equity shares of the Company are listed i.e. BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com within two (2) working days from the date of conclusion of e-voting period.

For HDB Financial Services Limited
Sd/-
Dipti Jayesh Khandelwal
(Company Secretary)
Membership No.:F11340

Place: Mumbai
Date: August 4, 2025

ROAD INFRASTRUCTURE DEVELOPMENT COMPANY OF RAJASTHAN LTD.
701-706, 7th Floor, ARG Corporate Park, Gopalbari, Ajmer Road, Jaipur – 302 001.
Tel.: +91 141 2747001, E-mail: office@rdcor.in, Website: www.rdcor.in, CIN: U45203RJ2004PLC019850

RIDCOR/PR/JADM/NEW-519/2025/323 E-NIT Date: 04.08.2025
RIDCOR intends to invite online tenders through e-procurement for various works as per details given below:

S. N.	Description	Name of Roads	Period for downloading the Bid document	Online Bid Opening Date
1	Collection of user fee and operation of toll plazas for the period from 01.09.2025 to 31.03.2026 (212 days)	1. Hanumangarh-Kishangarh (HK) 2. Hanumangarh-Sangaria (HS)	From 05.08.2025 (15:30 Hrs) to 18.08.2025 (18:00 Hrs)	19.08.2025 (11:30 Hrs)

All the particulars/details and amendments related to this E-NIT can be viewed on the website <http://eproc.rajjasthan.gov.in>. Interested agencies/firms are required to be registered on this website through digital signatures.

Director

KRYPTON INDUSTRIES LIMITED
CIN: L25199WB1990PLC048791
Regd. Office: Banganagar, Diamond Harbour Road, Falta, Fatelpur (South 24 Parganas), West Bengal - 743 513, IN
Head Office: 410, Vardaan Building, 25A, Camac Street, Kolkata-700 016
E-mail: Krypton@kryptongroup.com, Website: www.kryptongroup.com

Pursuant to SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated 02nd July, 2025, all shareholders are hereby informed that a Special Window is being opened for a period of 6(six) months, from 07th July, 2025 to 06th January, 2026 to facilitate re-lodgement of transfer requests of physical shares. This facility is available for Transfer deeds lodged prior to 01st April, 2019 and which were rejected, returned or not attended due to deficiencies in documents/process/or otherwise.

Investors who have missed the earlier deadline of 31st March, 2021 are encouraged to take advantage of this opportunity by furnishing the necessary documents to the Company's Registrar and transfer agent (RTA) i.e., Maheshwari Datamatics (P) Limited at 23, R.N Mukherjee Road, Lal Bazar, Kolkata 700001, E-mail: mdpldc@yahoo.com.

All shares re-lodged during the aforesaid period will be processed on merits through the transfer-cum demat mode i.e., they will be issued only in dematerialised form after transfer. The lodger must have a demat account number and provide his/her Client Master List, along with the transfer documents and share Certificates, while lodging the documents for transfer with RTA Transfer request submitted after 06th January, 2026 will not be accepted by the Company/RTA.

For Krypton Industries Limited
Sd/-
Priya Agarwal
Company Secretary & Compliance Officer

Place: Kolkata
Date: 04.08.2025

TAAL ENTERPRISES LIMITED
Regd. Off.: AKR Tech Park, 3rd Floor, C Block, Sy # 112 Krishna Reddy Industrial Area, 7th Mile Hosur Road, Singasandra, Bangalore, South Bangalore-560068, Karnataka, India
Phone/ Fax: 080-67300200/080- 67300201; Email: secretarial@taalent.co.in
Website: www.taalent.co.in; CIN: L74110KA2014PLC176836

NOTICE OF 11TH ANNUAL GENERAL MEETING OF THE COMPANY

Notice is hereby given that 11th Annual General Meeting (AGM) of TAAL Enterprises Limited ("The Company") will be held on Tuesday, August 26, 2025 at 12:00 P.M. (IST) through Video Conference (VC) / Other Audio Visual Means (OAVM) in compliance with the applicable provisions of the Companies Act, 2013 read with General Circular No. 20/2020, 14/2020, 17/2020, 2/2021, 2/2022, 10/2022, 09/2023 and 09/2024 dated 5th May, 2020, 8th April, 2020, 13th April, 2020, January 13, 2021, May 05, 2022, December 28, 2022 and September 25, 2023 and September 19, 2024 respectively, and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May 2020 read with circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January 2021 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated 13th May 2022 and SEBI/HO/CFD/PoD-2/CIR/2023/4 dated 5th January 2023 and SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/167 dated 7th October 2023 and SEBI/HO/CFD/PoD-2/P/CIR/2024/133 dated October 3, 2024 ("SEBI Circulars") without the physical presence of members at a common venue.

The Notice and Annual Report is being sent only by electronic mode to all those members whose email addresses are registered with the Company / Depositories in accordance with the applicable Circulars. Members can join and participate in the AGM only through VC/OAVM facility.

The Company is providing its members remote e-voting facility to cast their vote on all resolutions set forth in the AGM Notice. Additionally, the Company is providing the facility of voting through the e-voting system (e-voting) during the AGM. The business may be transacted through voting by electronic means. The detailed instructions for remote e-voting and e-voting are provided in the Notice of AGM that is being e-mailed to the members.

Members participating through the VC/OAVM facility will be counted for the purpose of reckoning the quorum under the Section 103 of the Act.

The Notice and Annual Report is available on Company's website www.taalent.co.in as well as website of BSE Ltd at www.bseindia.com and also on website of NSDL at www.evoting.nsdl.com.

Members holding Shares in Physical form as well as in Dematerialized form and who have not registered their email addresses with the Company/Depositories are requested to register their email addresses with the Company's Registrar and Share Transfer Agent MUFG Intime India Private Limited at ashok.sherugar@in.mpms.mufg.com or with the Company at secretarial@taalent.co.in to receive the Notice of the AGM along with the Annual Report. Instructions to join the AGM through VC/OAVM and to cast the vote through remote e-voting / e-voting are contained in the Notice of the AGM.

The remote e-voting commences on Thursday, August 21, 2025 (9:00 am) and ends on Monday, August 25, 2025 (5:00 pm). Remote e-voting shall not be allowed beyond 5:00 pm on August 25, 2025.

A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on cut-off date i.e. August 19, 2025 shall be entitled to avail the facility of remote e-voting as well as voting in the AGM.

In case of persons who became members of the Company after dispatch of AGM Notice may write an e-mail to pune@in.mpms.mufg.com or secretarial@taalent.co.in for obtaining login ID & password.

A Member may participate in AGM even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the AGM. The facility for e-voting shall be made available at the AGM.

In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evoting.nsdl.com under help section or write an email to evoting@nsdl.co.in.

For TAAL ENTERPRISES LIMITED
Aditya Shashikant Oza
Company Secretary

Date: August 05, 2025
Place : Pune

FORTIS MALAR HOSPITALS LIMITED
(CIN: L85110PB1989PLC045948)
Regd. Office: Fortis Hospital, Sector 62, Phase – VIII, Mohali – 160062
Tel : +91 172 5096001; Fax No : +91 172 5096002
Website: www.fortismalarhospital.com; Email: secretarial.malar@malarhospitals.in


STATEMENT OF UN-AUDITED CONSOLIDATED & STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2025

(₹ in Lakhs except EPS)

Particulars	CONSOLIDATED		
	Quarter Ended June 30, 2025	Year Ended March 31, 2025	Quarter Ended June 30, 2024
	Un-Audited	Audited	Un-Audited
Total Revenue from Operations	2.05	-	-
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	428.49	39.66	(6.45)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	428.49	39.66	(6.45)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	415.27	36.05	(6.45)
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	415.27	36.05	(6.45)
Paid - Up Equity Share Capital (Face Value of Rs. 10/- per share)	1,875.70	1,875.70	1,875.70
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year (as at March 31, 2025)	NA	1,145.21	NA
Earnings Per Share (of Rs 10/- each) (for continuing and discontinued operations)			
(a) Basic (after exceptional items)	2.22	0.19	(0.03)
(b) Diluted (after exceptional items)	2.22	0.19	(0.03)

Particulars	STANDALONE		
	Quarter Ended June 30, 2025	Year Ended March 31, 2025	Quarter Ended June 30, 2024
	Un-Audited	Audited	Un-Audited
Total Revenue from Operations	-	-	-
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	430.87	39.76	(5.81)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	430.87	39.76	(5.81)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	417.65	36.17	(5.81)
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	417.65	36.17	(5.81)
Paid - Up Equity Share Capital (Face Value of Rs. 10/- per share)	1,875.70	1,875.70	1,875.70
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year (as at March 31, 2025)	NA	1,120.71	NA
Earnings Per Share (of Rs 10/- each) (for continuing and discontinued operations)			
(a) Basic (after exceptional items)	2.23	0.19	(0.03)
(b) Diluted (after exceptional items)	2.23	0.19	(0.03)

Notes:
1. The above is an extract of the detailed format of Standalone and Consolidated Financial Results for the Quarter ended on June 30, 2025 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Results for the Quarter ended on June 30, 2025 are available on the Website of the Stock Exchange viz. www.bseindia.com and that of the company at www.fortismalarhospital.com.
2. The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.
3. # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.


For and on Behalf of Board of Directors
Sd/-
Chandrasekar R
Whole-time Director
DIN: 09414564

Place: Bengaluru
Date: August 4, 2025

BHAXNARI HOSIERY EXPORTS LIMITED
Regd. Office: Bhaxnari House, Village, Mahamandi, Rahon Road, Ludhiana-141007 (Punjab) (India)
Phone: +91-88720-16410, Fax: +91-161-2603934, E-mail: bhaxnari@bhandariexport.com
Web: www.bhandariexport.com, CDSL-1171569195PSU01C1930

NOTICE OF 32nd ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE, NOTICE OF DIVIDEND AND DIVIDEND NOTICE: The notice given that the 32nd Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Thursday, the 28th day of August, 2025, at 3.30 A.M. at the Registered Office of the Company at Bhaxnari House, Village, Mahamandi, Rahon Road, Ludhiana-141007 to transact the Ordinary and Special Businesses as set out in the Notice convening the 32nd AGM. The Notice of the 32nd AGM and the Annual Report 2024-25 have been sent electronically to all members whose e-mail addresses are available and a letter providing the web-link, including the exact path, where complete details of the Annual Report are available is sent to such shareholders who have not registered their email ID. The aforesaid documents are also available on the Company's website at www.bhandariexport.com and on the website of the Stock Exchanges, i.e., BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com, respectively. Notice of AGM is also available on the website of CDSL at www.evotingindia.com.

Notice of Book Closure is also hereby given that pursuant to Section 91 of the Companies Act, 2013 that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, the 22nd August, 2025 to Thursday 28th August, 2025 (both days inclusive) for the purpose of Annual General Meeting of the Company and payment of dividend, if any, for both physical and electronic securities. Equity Dividend, if declared at the said meeting, will be paid to those members whose names appear on the Register of Members as on 21st day of August, 2025.

Remote E-Voting: Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and pursuant to the provisions of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has provided remote e-voting facility to all members irrespective of holding shares in de-materialized mode or in physical mode. Members are further notified that they may cast their vote on all business to be conducted at the AGM through remote e-voting services provided by CDSL. The detailed procedure instruction for e-voting have been sent along with the Notice and Annual Report.

1. The remote e-voting period commences on 25th August, 2025 (9.00 a.m.), Monday and ends on 27th August, 2025 (5.00 p.m.), Wednesday. During this period, Members of the Company, holding shares both in physical form or in dematerialized form, as on the cut-off date (record date) of Thursday, 21st day of August, 2025, may cast their vote by remote e-voting. The remote e-voting module shall be disabled by CDSL for voting thereafter.

2. Any person, who acquires shares and becomes member of the Company after dispatch of the Notice of the AGM and holding shares as of the cut-off date i.e. Thursday, 21st day of August, 2025 may obtain the login ID and password by sending a request at helpdesk.evoting@cdsindia.com or cs@bhandariexport.com. However, if a person is already registered with CDSL for e-voting then existing user ID and password can be used for casting the vote.

3. The facility for voting, either through electronic voting system or ballot or polling paper shall also be made available at the meeting and members attending the meeting who have not already cast their vote may exercise their vote through electronic voting system or ballot or polling paper at the AGM.

4. A member may participate in the AGM even after exercising his/her right to vote through remote e-voting but shall not be allowed to vote again at the AGM.


5. A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM.

6. All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dhill, Sr. Manager, (CDSL), Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futre, Metafil, MI Compounds, N-03 Mohi Nagar, Lower Parel (East), Mumbai-400013 or send an email to helpdesk.evoting@cdsindia.com or call at toll free no. 1800-211 09911.

7. The Board of Directors has recommended payment of dividend at the rate of Re 0.02 per share on Rs. 1/- face value for FY 2024-25 subject to approval of shareholders at AGM and dividend shall be paid within 30 days of declaration to those members whose names appear in Register of Members and beneficial owner's data at the close of working hours on 21.08.2025. To avoid delay in receiving dividend, Members are requested to provide / update their Bank Account details (including MICR No., IFSC Code, Account Type etc.) with their DPs if shares are held in demat form and with RTA if shares are held in physical form, to receive dividend directly in their bank account on the payout date. As per IT Act, dividend paid after 01.04.2020 shall be taxable in the hands of shareholders and Company shall deduct TDS at the time of dividend payment. The mode of summing up the applicable TDS provisions in accordance with the provisions of the IT Act, for various member categories, including Resident or Non-Resident members together with documentation requirements from members in this regard is provided in the Notice of the AGM. For any queries or issues regarding e-voting please refer to the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com in under help section or write an email to helpdesk.evoting@cdsindia.com. Members may address their queries / grievances, if any to the Registrars and Share Transfer Agents of the Company - M/S MUFING INTIME INDIA PVT. LTD. (formerly known as Link Intime India Private Limited), Noble Heights, 1st Floor, Plot No. 12, S.L.C., C-1 Block, Near Savitri Market, Janakpuri, New Delhi-110058. Email: delhi@n.mps.mutual.com, PHONES: 022-4918 6000, FAX: 011-4410591 or to the Company Secretary at Registered Office or email at investor@bhandariexport.com or on contact No. 88720-16410

By Order of the Board
Date : 04-08-2025
Place : Ludhiana
Sd/- **Chhila Tiwari**
Company Secretary & Compliance Officer

[illegible]


GULSHAN POLYOLS LIMITED
 CIN: L24231UP2000PLC034918
Regd. Office: 9th K.M., Jansath Road, Muzaffarnagar – 251001, Uttar Pradesh, India
Corporate Office: G-81, Preet Vihar, Delhi-110092, India
Phone: +91 11 49999200; **Fax:** +91 11 49999202
E-mail: cs@gulshanindia.com; **Website:** www.gulshanindia.com

Notice to Shareholders

Transfer of Equity Shares of the Company & Unclaimed Final Dividends declared in 2017-2018 to Investor Education & Protection Fund ("IEPF")

This notice is published pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 ("Act") read with Rule 6 of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules"), as amended. Section 124 of the Act and the Rules, inter-alia, provide that all unclaimed dividend and shares in respect of which dividend has remained unpaid or unclaimed for seven consecutive years or more shall be transferred by the Company in the name of investor Education and Protection Fund (IEPF).

Final Dividend declared by the Company for the financial year 2017-18 ("Dividend") and the corresponding shares on which dividend(s) were unclaimed for seven consecutive years is becoming due for transfer to the IEPF on November 10, 2025. The transfer to the IEPF shall be made within a period of thirty days from November 10, 2025.

In respect of the aforesaid Dividend, individual communication(s) is being sent by the Company to the concerned shareholders whose dividend and shares are liable to be transferred to IEPF and whose dividend has remained unpaid or unclaimed for seven consecutive years, at their latest available address with the Registrar and Share Transfer Agents/Depositories, providing complete details of the shares due for transfer to IEPF. The Company has uploaded the details of such shareholders and shares due for transfer to IEPF on its website <https://www.gulshanindia.com/transfered-iefp.html>. The shareholders may access the website of the Company to verify the details of the shares liable to be transferred to IEPF.

Procedure for claiming unclaimed dividend

As per SEBI circular/notification, shareholders holding shares in physical form are required to send duly filled Form No. ISR-1, Form No. ISR-2, Form No. SH-13 or ISR-3 and other supporting documents including original cancelled cheque along with request letter. The said forms are available on Company's website at www.gulshanindia.com. As per the aforesaid SEBI Circulars, outstanding dividend payments will be credited directly to the bank account of the shareholders holding shares in physical form if the folio is KYC compliant and Nomination details are received.

In case shares are held in demat form, shareholders are required to send request letter along with a copy of the client master list and original cancelled cheque.

Please note that in the absence of bank details registered against your account with the RTA/Depository Participant, the payment of outstanding dividend amount cannot be processed.

Shareholders are requested to immediately claim the unclaimed amount(s) due to them by sending aforesaid documents to Alankit Assignments Limited, Registrars and Transfer Agents (RTA) or to the Company, on or before October 9, 2025. You can also send scan copy of documents as per aforesaid SEBI circulars. If the documents are complete in all respects, the dividend will be credited to the bank account registered with the Company /RTA. Shareholders are requested to note that in case the dividend(s) is/are not claimed by October 9, 2025 those Equity share(s) in respect of which the dividend(s) remains unclaimed for seven consecutive years, shall be transferred to IEPF Authority without any further notice to the shareholders and no liability shall lie against the Company in respect of the Equity shares so transferred.

Mode of transfer of Equity shares to IEPF

In case of Equity Shares held in Physical form: Duplicate share certificate(s)/Letter of Confirmation(s) will be issued and the concerned depository shall convert the duplicate share certificate(s)/ Letter of Confirmation(s) into Demat form and shall transfer the shares in favour of the IEPF demat account. The original share certificate(s) registered in the shareholders' names will stand automatically cancelled and deemed non-negotiable."

In case of Equity Shares in demat form: Concerned depository will give effect to the transfer of the equity shares liable to be transferred in favour of the IEPF demat account by way of corporate action.

All future benefits arising on such shares will also be transferred to the IEPF Authority.

Claim from IEPF post transfer


Shareholders may note that both, unclaimed dividend and respective shares transferred to IEPF Demat Account including all benefits accruing on such shares, if any, can be claimed back from IEPF Authority, after following the procedure prescribed by Rules, and which is available on the website at www.gulshanindia.com.

For any query or assistance, please write to the Company at the above address/e-mail or to the Company's Registrar and Share Transfer Agent, Alankit Assignments Limited at Alankit House, 4E/2 Jhandewalan Extension, New Delhi-110055, India; Phone: +91-11-4254 1955/1234, +91-8929955314, +91-8929955318; Email: ramap@alankit.com, kycupdate@alankit.com, for prompt action.

For Gulshan Polyols Limited
Sd/-
Dr. Chandra Kumar Jain
Chairman & Managing Director
DIN: 00062220

Delhi, August 4, 2025

<div><div><div>SML ISUZU LIMITED</div><div>Registered Office: Village Asron, District Shahid Bhagat Singh Nagar (Nawanshahr), Punjab -144 533</div><div>Corporate Identification Number ("CIN"): L50101PB1983PLC005516</div><div>Tel. No.: +91 172 2647700-02; Website: www.smlisuzu.com</div></div></div>	
<div>Recommendations of the Committee of Independent Directors ("IDC") of SML ISUZU Limited ("Target Company") on the Open Offer (as defined below) made by Mahindra & Mahindra Limited ("Acquirer") to the Eligible Shareholders of the Target Company ("Shareholders"), under Regulation 26(f) of the Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011 and subsequent amendments thereto ("SEBI (SAST) Regulations").</div>	
1.	<div><div>Date</div><div>2nd August, 2025</div></div>
2.	<div><div>Name of the Target Company (TC)</div><div>SML ISUZU Limited</div></div>
3.	<div><div>Details of the Open Offer pertaining to the TC</div><div><p>Open offer for the acquisition of up to 37,62,628 (thirty seven lakh sixty two thousand six hundred and twenty eight) fully paid-up equity shares of the Target Company having face value of INR 10 each (Indian Rupees Ten only) ("Equity Shares"), representing 26.00% of the Voting Share Capital of the Target Company, at a price of INR 1,554.60 (Indian Rupees One Thousand Five Hundred Fifty Four and Sixty Paise only) per Equity Share ("Offer Price") from the Shareholders of the Target Company, in compliance with the requirements under the SEBI (SAST) Regulations ("Open Offer").</p><p>The public announcement dated 26th April, 2025 ("PA"), the detailed public statement published on 5th May, 2025 ("DPS"), the draft letter offered dated 13th May, 2025 ("DLOF"), and the letter of offer dated 30th July, 2025 ("LOF") have been issued by Kotak Mahindra Capital Company Limited ("Manager to the Offer") on behalf of the Acquirer.</p></div></div>
4.	<div><div>Name(s) of the Acquirer and PACs with the Acquirer</div><div><p>Acquirer: Mahindra & Mahindra Limited PACs: There are no persons acting in concert (PACs) with the Acquirer for the purposes of the Open Offer.</p></div></div>
5.	<div><div>Name of the Manager to the Open Offer</div><div><p>Kotak Mahindra Capital Company Limited Registered Address: 27BKCC, 1st Floor, Plot No. C-27, 'G' Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai 400 051 Contact Person: Mr Ganesh Rane Tel. No.: +91 22 6218 5905 Fax No.: +91 22 6713 2447 Email: smlisuzu.openoffer@kotak.com SEBI Registration Number: INM0000008704 Validity Period: Permanent Registration</p></div></div>
6.	<div><div>Members of the Committee of Independent Directors (Please indicate the chairperson of the Committee separately)</div><div><p>a. Mr. C.S. Verma (Chairperson) b. Mr. Arun Kumar Malhotra (Member) c. Mr. Ravi Venkatraman (Member)</p></div></div>
7.	<div><div>IDC Member's relationship with the TC (Director, equity shares owned, any other contract/ relationship), if any</div><div>All members of the IDC are independent directors on the board of directors of the Target Company. None of the members of the IDC hold any equity shares or other securities of the Target Company or have any contract/ relationship with the Target Company other than their appointment as independent directors of the Target Company.</div></div>
8.	<div><div>Trading in the equity shares/ other securities of the TC by IDC Members</div><div><p>None of the members of the IDC have traded in any of the equity shares/ securities of the Target Company during the:</p><p>(a) 12 months period preceding the date of the PA; and (b) period from the date of the PA and till the date of this recommendation.</p></div></div>
9.	<div><div>IDC Member's relationship with the Acquirer and PACs (Director, equity shares owned, any other contract/ relationship), if any.</div><div><p>None of the members of the IDC are on the board of the Acquirer/ hold any equity shares of the Acquirer or have any contract/ relationship with the Acquirer, except for the following:</p><p>(a) Mr. Arun Kumar Malhotra holds 7,400 shares of the Acquirer, and (b) Mr. Ravi Venkatraman and one of his relatives hold an aggregate of 1,356 shares of the Acquirer.</p></div></div>
10.	<div><div>Trading in the equity shares/ other securities of the Acquirer and PACs by IDC Members</div><div><p>None of the members of the IDC have traded in any of the equity shares/ securities of the Acquirer during the: (a) 12 months period preceding the date of the PA, and (b) period from the date of the PA and till the date of this recommendation.</p></div></div>
11.	<div><div>Recommendation on the Open Offer, as to whether the offer is fair and reasonable</div><div><p>The IDC has perused the PA, DPS, DLOF and LOF issued by the Manager to the Offer on behalf of the Acquirer, in connection with the Open Offer.</p><p>SSPA & CO., Chartered Accountants ("SSPA"), which was appointed by the IDC to provide its independent opinion with respect to the Offer Price, has provided its opinion that: (i) the Offer Price offered by the Acquirer is in accordance with the Regulation 8(2) of SEBI (SAST) Regulations; and (ii) the Offer Price is fair and reasonable as on PA date.</p><p>Based on the above, the IDC is of the opinion that the Offer Price of INR 1,554.60 (Indian Rupees One Thousand Five Hundred Fifty Four and Sixty Paise only) per Equity Share is in accordance with the applicable regulations of the SEBI (SAST) Regulations and appears to be fair and reasonable.</p></div></div>
12.	<div><div>Summary of reasons for recommendations</div><div><p>The IDC has perused the PA, DPS, DLOF and LOF issued by the Manager to the Offer on behalf of the Acquirer, in connection with the Open Offer, and the report dated 31st July, 2025 provided by SSPA, independent advisor to the IDC.</p><p>The recommendation of the IDC set out in paragraph 11 above is based on the following:</p><p>a. The Offer Price is in accordance with Regulation 8(2) of the SEBI (SAST) Regulations i.e., being highest of the prescribed parameters. The Offer Price is (i) higher than the negotiated price for acquisition of Equity Shares held by the Acquirer, i.e., INR 650 (Indian Rupees Six Hundred and Fifty only); and, ii) equal to the volume-weighted average market price of the Equity Shares during the period of 60 trading days immediately preceding the date of the PA, i.e., INR 1,554.60 (Indian Rupees One Thousand Five Hundred Fifty Four and Sixty Paise only) per Equity Share; and</p><p>b. The report dated 31st July, 2025 provided by SSPA, independent advisor to the IDC, stating that: (i) the Offer Price offered by the Acquirer is in accordance with the Regulation 8(2) of SEBI (SAST) Regulations; and (ii) the Offer Price is fair and reasonable as on PA date.</p><p>However, the members of the IDC draw attention of the Shareholders to the closing market price of the Equity Shares of the Target Company on the National Stock Exchange of India Limited ("NSE") and BSE Limited ("BSE") as on 1st August, 2025, being INR 3,471.30 and INR 3,469.40 per Equity Share, respectively, which is higher than the Offer Price.</p><p>The Shareholders of the Target Company are advised to independently evaluate the Open Offer and take an informed decision about tendering the Equity Shares held by them in the Open Offer.</p><p>This statement of recommendation will be available on the website of the Target Company at: www.smlisuzu.com</p></div></div>
13.	<div><div>Details of voting pattern</div><div>The recommendations were unanimously approved by the members of the IDC present at the meeting of the IDC held on 2nd August, 2025.</div></div>
14.	<div><div>Details of Independent Advisors, if any</div><div>SSPA & CO., Chartered Accountants</div></div>
15.	<div><div>Any other matter to be highlighted</div><div>None</div></div>
<div>To the best of our knowledge and belief, after making proper enquiry, the information contained in or accompanying this statement is, in all material respects, true and correct and not misleading, whether by omission of any information or otherwise, and includes all the information required to be disclosed by the Target Company under the SEBI (SAST) Regulations.</div>	
<div><div>For and on behalf of the Committee of the Independent Directors of SML ISUZU Limited</div><div><div>C.S. Verma</div><div>Chairperson – Committee of Independent Directors</div><div>DIN: 00121756</div></div></div>	



ભારતીય સ્ટેટ બેંક

સેફ્ટી એસેટ્સ રીકવરી લાયન્સ, વોલેટ્ટા : બીજો તાલુકો, સાંચક સ્ટેટ્સ, ડી.આર. અમીન સ્કુલની સામે, દિવાળીપુરા મેઈન રોડ, વોલેટ્ટા - ૩૮૦૦૦૭.

સરકારેશી અધિનિયમ-૨૦૦૨

ના કલમ ૧૩(૨)

હેફળ નોટીસ

આથી એક નોટીસ આપવામાં આવે છે કે ઉપારકતો બેંક શ્રી નરેશભાઈ જગદીશભાઈ સોલંકી અને શ્રીમતી ગીતીબેન જગદીશભાઈ સોલંકી એ બેંક પાસેથી જાગેલી લોન સુવિધાના મુલ્ય અને વ્યાજની રૂચવણીમાં ફિક્સેટ થયા છે અને લોનને નોન - પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. ઉપારકતો અને શ્રીમતીબેન આપનારને તેમના છેલ્લા જાણીતા સરનામાંએ પર સિક્યોરીટીડેફેન્સ એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ ફિક્સેટ નોટીસોની ઈન્ટરેસ્ટ એન્ટ ૨૦૦૨ ની કલમ ૧૩(૨) હેઠળ નોટીસ આપવામાં આવી હતી, પરંતુ તે માોકવેલ હતી પણ પરત કરવામાં આવેલ છે અને આથી એનએ અને આઈએસટી નોટીસ દ્વારા જાણ કરવામાં આવે છે.

ઉપારકતોનો નામ	વિવરતોનું વિગતો/ સુચકી સહઅવગતોનું લાગુ કરવામાં	નોટીસની તારીખ	એનપીએ ની તારીખ	બાકી વહેંચી રકમ (નોટીસના દિવસ પ્રમાણે)
શ્રી નરેશભાઈ જગદીશભાઈ સોલંકી શ્રીમતી ગીતીબેન જગદીશભાઈ સોલંકી	તમામ બાજ એને હિસ્સા સાથેની સ્થાવર સિલકતોનો ફેલેટ નં. બી-૧૦૨, પહેલો માળ, ટાવર - બી, કાસ્ટા સેડીંગ્સની, બેંક ઓફ બરોડાની પાસે, વડવાર, વોલેટ્ટા, જલ્લો - વોલેટ્ટા, જેનું આશરે સેત્રકલ ૫૧.૧૬ સે.મી., બાંધકામ ક્લેલ જમીનનો રેવન્યુ સેત્રકલ નં. ૭૪/૧, ગામ - વડવાર, જલ્લો - વોલેટ્ટા, જેનું આશરે સેત્રકલ ૭૬.૮૮ સે.મી., સખ સેત્રકલના જલ્લો અને જલ્લો - વોલેટ્ટા - વોલેટ્ટા. સત્તુ-સીમા - ન- સુપ્ડ : ફેલેટ નં. એ-૧૦૧, પાકિમો : ફેલેટ નં. સી-૧૦૨, ઉત્તર : ફેલેટ નં. બી-૧૦૩, દક્ષિણ : ખુલ્લુ ખેતર.	૨૭.૦૬.૨૦૧૫	૨૦.૧૨.૨૦૧૬	રૂ. ૨૩,૦૩,૯૦,૮૯ (૨૩. નેવીશ લાખ તોતેર લાખ આઠસો એક અને નેવાણું પાંચ પુરા) ના રૂ.૦.૬.૨૦૨૫ ના સુબીપા


નોટીસની અરજ સેવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરોક્ત ઉપારકતો અને શ્રીમતીબેન (જયારે પણ લાગુ પડે) ને આ નોટીસના પ્રકાશનની તારીખથી ૭૮ દિવસની અંદર બાકી રકમની રૂચવણી કરવા માટે અહવાન કરવામાં આવે છે, જે નિષ્ફળ પડે તો સિક્યોરીટીડેફેન્સ એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ ફિક્સેટ નોટીસોની ઈન્ટરેસ્ટ એન્ટ ૨૦૦૨ હેઠળ કલમ ૧૩ ની પેઠા કલમ ૨ હેઠળ આ નોટીસની તારીખથી ૭૮ દિવસની મુદત પૂરી થયા પછી આગળના પગલાં લેવામાં આવશે. સરકારેશી કાયદાની કલમ ૧૩ની પેઠા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે ઉપારકતોનું મુકરમ મિકેનિઝમ દ્વારામાટે માંગવા પામ સમય માન્ય થયાના દોરવામાં આવે છે.

તારીખ : ૦૪.૦૮.૨૦૨૫, સ્થળ : વોલેટ્ટા

(વિવાદ ની વિગતોમાં કોઈએ લાગુદેવે માન્ય રાખવામાં આવશે)

અધિકૃત અધિકારી, ભારતીય સ્ટેટ બેંક

[illegible]

 torrent- ELECTRICALS CIN: U31904GJ2019PLC110463; Website: www.torrentelectricals.com ; E-mail: cs@torrentpower.com	TORRENT ELECTRICALS LIMITED Torrent Power Limited-Cables Unit, Yoginagar Mission Road, Nadiad-387002				
	EXTRACT OF STATEMENT OF FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2025 (₹ in Crore except per share data)				
	Particulars	Quarter ended			Previous year ended
		30.06.2025	31.03.2025	30.06.2024	31.03.2025
		Un-Audited	Un-Audited	Un-Audited	Audited
Total income from Operations	267.25	203.46	174.67	747.53	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	9.73	(1.87)	(2.94)	(19.47)	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	9.73	(1.87)	(2.94)	(19.47)	
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	6.67	0.57	(2.14)	(12.93)	
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	6.51	(0.07)	(2.31)	(13.59)	
Paid up Equity Share Capital	210.00	210.00	84.00	210.00	
Reserves (excluding Revaluation Reserve)	-	-	-	(83.81)	
Securities Premium Account	-	-	-	-	
Net Worth	210.00	210.00	84.00	126.19	
Paid up Debt Capital / Outstanding Debt	-	-	-	-	
Debt Equity Ratio	0.05	-	(41.53)	-	
Earnings Per Share (of ₹ 10/- each) (for continuing and discontinued operations)					
Basic (₹)	0.32	0.57	(0.25)	(1.47)	
Diluted (₹)	0.32	0.57	(0.25)	(1.47)	
Capital Redemption Reserve	-	-	-	-	
Debenture Redemption Reserve	-	-	-	-	
Debt Service Coverage Ratio	1.33	0.08	(0.01)	0.09	
Interest Service Coverage Ratio	1.33	1.11	(5.72)	0.80	
Notes :					
1. The above is the extract of the detail financial results for the quarter ended June 30, 2025 filed with the National Stock Exchange (NSE) under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of the same, along with the notes, are available on the websites of NSE at www.nseindia.com and also on the company's website at www.torrentelectricals.com .					
2. For the other line items referred in Regulation 52 (4) of the SEBI (LODR), the pertinent disclosures have been made to NSE and can be accessed on www.nseindia.com .					
Place : Ahmedabad Date : August 04, 2025					
